



RAN-2308000106051015

T.Y.B. Com. (Sem. VI) Examination October - 2025

Indirect Tax Paper - VII

સૂચના : / Instructions

- (1) ઉપરોક્ત દર્શાવેલ વિગતો ઉત્તરવહી પર અવશ્ય લખવી.
Fill up strictly the above details on your answer book
- (2) હેતુલક્ષી પ્રશ્નોના જવાબ આપો.

Seat No.:

--	--	--	--	--	--

Student's Signature

પ્ર-1.

હેતુલક્ષી પ્રશ્નોના જવાબ આપો

15

- 1) માલના પુરવઠા માટે કયો સમય ગણાય?
(અ) ભરતિયું બનાવી આપ્યા તારીખ.
(બ) ભરતિયું આપવાની છેલ્લી તારીખ.
(ક) એડવાન્સ રકમ મળ્યા તારીખ
(ડ) ઉપરના તમામ ત્રણ તારીખ પૈકી જે વહેલી હોય તે
- 2) GST એક્ટ હેઠળ સેવાના પુરાવઠાનું સ્થળ કયું ગણાય?
- 3) નોંધણી નંબરમાં પ્રથમ બે ડીજીટ શું દર્શાવે છે?
(અ) રાજ્યનો કોડ
(બ) પાન નંબર
(ક) વ્યક્તિનો નંબર
(ડ) માલનો નંબર
- 4) માનવ વપરાશ માટેના દારૂ અને પેટ્રોલિયમ પેદાશો અને વીજળી પર લાગે છે?
- 5) નોંધણી નંબરમાં 3 થી 12 નંબર દર્શાવે છે?
- 6) આકસ્મિક વેરાપાત્ર વ્યક્તિ અથવા બિન-નિવાસી વેરાપાત્ર વ્યક્તિ એ ક્યારે નોંધણી માટે અરજી કરવાની હોય છે?
- 7) માલ કે સેવાના પુરવઠા માટે કઈ કલમ લાગુ પડે છે?
(અ) કલમ 12 અને 13
(બ) કલમ 12 અને 11
(ક) કલમ 13 અને 14
(ડ) કલમ 10 અને 11
- 8) ગ્રાહક કલ્યાણ ફંડ માટે કઈ કલમ લાગુ પડે છે?
(અ) 57
(બ) 75
(ક) 58
(ડ) 85
- 9) GST એક્ટ મુજબ કલમ 59 કોને લાગુ પડે છે?
(અ) સ્વ આકારણી
(બ) ઓડિટ
(ક) કામચલાવ આકારણી
(ડ) રિફંડ
- 10) FOBનું લાંબુ સ્વરૂપ આપો.
- 11) CIFનું લાંબુ સ્વરૂપ આપો.
- 12) ફરજિયાત નોંધણી માટે સેવાનું કેટલું ટર્ન ઓવર ઉત્તર પૂર્વેના રાજ્યો માટે હોય તો ફરજિયાત નોંધણી નંબર મેળવવો પડે છે?
(અ) 10 લાખથી વધુ અને 75 લાખ
(બ) 40 લાખથી વધુ અને 95 લાખ
(ક) 10 લાખથી વધુ અને 50 લાખ
(ડ) 20 લાખથી વધુ અને 1 કરોડ

- 13) CBIT & Cનું લાંબુ સ્વરૂપ આપો.
 14) રીફંડ માટે કઈ કલમ લાગુ પડે છે?
 (અ) 57 (બ) 75
 (ક) 58 (ડ) 54
 15) IGST કોની સામે સરભર થાય છે?
 (અ) IGST (બ) CGST
 (ક) SGST (ડ) ઉપરના તમામ

પ્ર-2. નીચેના પ્રશ્નોના જવાબો આપો. (ગમે તે ચાર) 08

- 1) ગ્રાહક કલ્યાણ ફંડમાં કઈ રકમ જમા થાય છે? અને તેનો ઉપયોગ જણાવો.
- 2) કરપાત્ર પુરવઠો એટલે શું?
- 3) ઈનપુટ ટેક્સ એટલે શું?
- 4) વાર્ષિક પત્રક એટલે શું?
- 5) આકસ્મિક કરપાત્ર ઘટના ઉદાહરણ સહિત સમજાવો.
- 6) સ્વ આકારણી અંગે સમજાવો.
- 7) SCVD અને BCD નું લાંબુ સ્વરૂપ આપો.
- 8) રીફંડ એટલે શું?

પ્ર-3. (અ) ઈલેક્ટ્રોનિક લેજર એટલે શું? અને ઈલેક્ટ્રોનિક રોકડ ખાતાવહી, જમા ખાતાવહી અને જવાબદારી ખાતાવહી સમજાવો. 06

(બ) કસ્ટમ કાયદા-1962 મુજબ કસ્ટમ ડ્યુટીનું મૂલ્યાંકનની પદ્ધતિ જણાવો અને કોઈ પણ ત્રણ ઉદાહરણ સહિત સમજાવો? 07

OR

પ્ર-3. (અ) કસ્ટમ કરના પ્રકાર જણાવો. કોઈ પણ ત્રણ ઉદાહરણ સહિત સમજાવો? 06

(બ) કઈ પરિસ્થિતિમાં માટે GSTની નોંધણી ફરજિયાત છે? 07

પ્ર-4. (અ) નીચેના પ્રશ્નોના જવાબ આપો. (ગમે તે બે) 8

- 1) કસ્ટમ કાયદા-1962 મુજબ કલમ 14(1) અને કલમ 14(2) કસ્ટમ ડ્યુટીનું મૂલ્યાંકન સમજાવો.
- 2) GSTમાં ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવા માટેની શરતો જણાવો?
- 3) મિશ્ર પુરવઠો અને સયુક્ત પુરવઠા વચ્ચેનો તફાવત સમજાવો.
- 4) ઈનપુટ ટેક્સ ક્રેડિટ શાની સામે સરભર થશે? અને તેની સમય મર્યાદા.

પ્ર-4. (બ) નીચેના પ્રશ્નોના જવાબ આપો. (ગમે તે બે) 6

- 1) ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ હેઠળ પુરવઠાનો અર્થ અને કાર્યક્ષેત્ર સમજાવો.
- 2) GST એક્ટ 2017 હેઠળ વેરાની ચૂકવણીના લક્ષણો સમજાવો.
- 3) નોંધણીની પ્રક્રિયા વર્ણવો.
- 4) સ્વ આકારણી અને ઓડિટ

ENGLISH VERSION

Q.-1. Answer objective questions

(15)

- (1) What is the time for supply of goods?
 - (a) The date on which the invoice has been made.
 - (b) The last date for payment of invoice.
 - (c) Date of receipt of advance amount
 - (d) All the above three dates whichever is earlier
- (2) What is the place of supply of service under the GST Act?
- (3) What does the first two digits represent in the registration number?
 - (a) State Code
 - (b) PAN Number
 - (c) Person's Number
 - (d) Number of Goods
- (4) Liquor and petroleum products and electricity for human consumption are _____ ?
- (5) Number 3 to 12 in registration number represents _____ ?
- (6) When for registration of casual taxable person or non-resident taxable person have to apply?
- (7) Which clause applies to supply of goods or services.
 - (a) Sections 12 and 13
 - (b) Sections 12 and 11
 - (c) Sections 13 and 14
 - (d) Sections 10 and 11
- (8) Which clause is applicable to Consumer Welfare Fund?
 - (a) 57
 - (b) 75
 - (c) 58
 - (d) 85
- (9) As per GST Act Section 59 is applicable to whom?
 - (a) Self assessment
 - (b) Audit
 - (c) Work assessment
 - (d) Refund
- (10) Give the full form of FOB.
- (11) Give the full form of CIF.
- (12) How much services turn over for compulsory registration (for North East States) if any Mandatory registration number has to be obtained.
 - (a) Above 10 lakhs and 75 lakhs
 - (b) Above 40 lakhs and 95 lakhs
 - (c) Above 10 lakhs and 50 lakhs
 - (d) Above 20 lakhs and 1 crore
- (13) Full form of CBIT & C?
- (14) Which clause is applicable to Refund ?
 - (a) 57
 - (b) 75
 - (c) 58
 - (d) 54
- (15) Against whom is IGST setoff ?
 - (a) IGST
 - (b) CGST
 - (c) SGST
 - (d) All of the above

Q-2. Answer in Brief (Give any four)

(8)

- (1) Which amount is credited in consumer welfare funds and give its utilization.
- (2) What is Taxable supply?
- (3) What is an Input Tax ?
- (4) What is Annual return?
- (5) Explain with example Casual taxable person.
- (6) Explain about self-assessment
- (7) Give Full form of SCVD and BCD ?
- (8) What is refund ?

- Q-3. (A) What is electronic ledger? And Explain electronic cash, credit and liability ledger. (6)**
(B) State the methods of customs valuation and explain any one method with an example under the custom Act-1962. (7)

OR

- Q-3. (A)** State the types of customs duties and explain any three duty with an example. (6)
(B) What are the categories in which registration is compulsory under GST? (7)
- Q-4. (A) Give the answer of following Question (Any two)** (8)
(1) Explain the valuation of customs duty under section 14(1) and 14(2) of the Custom Act, 1962.
(2) which are the conditions for taking the benefits of input tax credit?
(3) Give differences between Mixed Supply and Composite Supply.
(4) What against setoff Input tax credit? And its time limit.
- Q-4. (B) Give the answer of following Question (Any two)** (6)
(1) Write down meaning and scope of the supply under to the GST Act.
(2) Write down characteristics of tax payment under the GST-2017.
(3) Describe the process of registration.
(4) Self-assessment and Audit
-